

July 8, 2020

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Advertisement in Newspapers under Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, we attached herewith Newspaper cuttings for the advertisement published in 'Gujarat Guardian' and 'The Financial Express' publication dated 08/07/2020 in the matter of **Notice of board meeting** of the Board of Directors of the Company is schedule to be held on Saturday, July 11, 2020, to consider and approve, inter-alia, the Audited Financial Results of the Company for the quarter and financial year ended on 31st March, 2020.

Kindly update this information on your website for investors/general public.

Thanking you.

For, Shahlon Silk Industries Limited

Hitesh K. Garmora Company Secretary

Reg. off: 91, G.I.D.C. Khatodara, Behind Sub-Jall, Ring Road, Surat-395 002, Gujarat, INDIA . Tel.: +91 261 2635551 - 53 & 57

+91 261 4190200 / 291

Fax: +91 261 2635552

CIN : 17120GJ2008PLC053464

E-mail: info@shahlon.com
Web: www.shahlon.com

ગુજરાતમાં	नवा	668	સાથે ૩૮	०७८ पोरि	પ્ટિક
શહેર	नवा	કુલ	મોત	ક્ઝા	એક્ટીવ
	કેસ	કેસ			કેસ
અમદાવાદ	१८७	રરરફર	૧૪૯૮(+ ७)	૧७૨૫૫(+૧૨૪)	зчое
સુરત	ર૪૫	७००૧	૨७०(+૧૧)	४२०६(+१४८)	૨૫૨૧
વડોદરા	६८	२७१८	૫७	૧૯૯૧(+૧૦૧)	ξωο
ગાંધીનગર	१८	७ ५४	39	પદ્દ૨(+૧७)	૧૬૧
ભાવવગક	૨૧	3 - 8	93	૧૮૯(+33)	૧૯૨
બનાસકાંઠા	૧૨	૨૬૪	૧૩(+૧)	૧૮૧(+ ૧૩)	ဖစ
આણંદ	૧૦	રપદ્	93	૨૧૫(+૫)	ર૮
રાજકોટ	४०	४७०	૧૧	૧૬૫(+૯)	કલ્૪
અરવલ્લી	०४	633	£3(+5)	९८८(+७)	55
મહેસાણા	૧૫	388	93	૧૬૪(+૨)	१६७
પંચમહાલ	ox	550	98	૧૫૮(+૪)	४६
બોટાદ	૦૧	૧૦૫	03	ξe	33
મહીસાગર	00	૧૬૧	0.5	996	૪૧
ખેડા	૧૧	556	૧૩(+૧)	१४०(+ ५)	૭ ૫
เยรเห	οų	૨૫૪	૧७	૧૩૯(+ ૧૧)	ec
ય્રામવગર	૧૦	500	οų	૧૫૮(+૧૦)	૧૧૪
ભરૂચ	૧૫	339	૧૦	૧ ૬૩(+૪)	૧૫૯
સાબરકાંઠા	0.5	50€	٥٥	૧૩૯(+૨)	ફર
ગીર સોમનાથ	03	ea	०१	чо	83
દાહોદ	οξ	૮૫	०१	४८	3ξ
છોટા ઉદેપુર	0.5	ξξ	0.5	४८(+७)	૧૬
કચ્છ	૧૪	50€	οξ	૧૧૦(+૧)	е3
નર્મદા	૦૧	eξ	00	८ ७(+3)	oe-
દેવભૂમિ હારકા	૦૧	૨૮	9.0	૧७	oe-
વલસાડ	૨૧	૨૫૦	03	८४(+१४)	૧૬૩
નવસારી	93	૧७૦	90	ω∈(+ ω)	۷e
रूतागढ	9.3	१८६	03	ξ3(+ ૪)	૧૨૦
પોરબંદર	00	૨૧	00	૧૫(+૨)	οξ
सुरेन्द्रनगर	૧૧	૨૧૧	٥٥	१०८(+२)	૯૫
મોરબી	οų	४८	०१	૧૯(+૧)	૨૮
તાપી	03	૨૮	00	٥٥	50
siəı	00	ox	00	ox	00
અમરેલી	οξ	900	06	४८	૪૫
કુલ આંકડો	४७७	36006	૨૦૫૨	રદ્દલ્લ	G033

સુરત મહાનગરપાલિકા સુધારેલું જાહેરનામું સંદર્ભઃ પી.આર.ઓ./૩૮/૨૦૨૦-૨૧, તા.૨૪/૦૪/૨૦૨૦

સરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત મુજબ જાહેરનામાથી મુરત મહાનગરપાલિકાના <u>સાઉથ ઇસ્ટ ઝોન (લીંબાયત)</u> ના સંજયનગર-ઉમરવાડા વિસ્તારમાં રહેતા લોકોને ક્લસ્ટર તરીકે જહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજીયાત હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા હુકમ કરવામાં આવેલ હતો, <u>જેમાં સુધારો કરી</u> <u>નીચે મુજબના વિસ્તારને હવેથી ક્લસ્ટર માંથી મુક્ત કરવા હુકમ કરું છું.</u>

ક્રમ	વિસ્તાર	અંદાજીત ઘરોની સંખ્યા	અંદાજીત વસ્તી
q	સોનિયા ગાંધી નગર ઝુંપડપટ્ટી	358	1611
5	આનંદ નગર ઝુંપડપટ્ટી	271	1220
3	સાકાર એપાર્ટમેન્ટ	40	220
8	મેઘાની ચાલવાળો વિસ્તાર	70	385
ч	સ્મીમેરની સામે રોડ ઉપર મકાન	15	83
ξ	હળપતિવાસ	60	330
9	સ્મીમેરની સામેની ઝુંપડપટ્ટી	40	220
۷	એમ જી. ક્રુટ માર્કેટ	10	45
C-	એમ.જી. કુટ માર્કેટની બાજુમાં	40	180
	중 લ:-	904	4294
नं.र्प	નં.પી.આર.ઓ./૨૮૫/૨૦૨૦-૨૧ કમિશનર		કમિશનર

UNION BANK OF INDIA युनियन र्भेङ ઓફ ઈન્ડિયા

di.o٤/o७/२०२०

વાપી જુઆઈડીસી શાખા : જુઆઈડીસી, વાપી સી-3 બિલ્ડીંગ, એડવાન્સ કોમ્પલેફ એન. એચ. નં. ૮, વાપી, જિ. બુલસર. ફોન: ૦૨૬૦-૨૪૨૧૨૯૨

<mark>યુનીયન બેંક ઓફ ઈન્ડિયાની</mark> નેશનલ હાઈવે ઉપર આવેલ **જી.આઈ.ડી.સી. વાપી** શાખામાં **રવિવાર**ન . **રોજ તા. ૦૫.૦७.૨૦૨૦, સાંજે ૬.૦૦ કલાકે** અમુક અજાણ્યા ઈસમો દ્વારા એ.ટી.એમ.મા લાગેલ ચેક ડોપ બોલ્સ તોડીને તેમાંથી શેલની ચોરી લગ્વામાં આવી હતી. આથી બધા સંબંધિત ગાહલોને જણાવવામાં આવે છે કે તારીખ ૦૪.૦૯.૨૦૨૦ સવારે ૧૧.૦૦ કલાકે થી તારીખ ૦૫.૦૯.૨૦૨૦, રાત્રે **૧૦.૦૦ કલાક** સુધી જે ગ્રાહકોએ ચેક ડ્રોપ બોક્સમાં ચેક નાખ્યા હોય તે વહેલા તે પહેલા શાખાના બ્રાંર મેનેજરનો સંપર્ક કરવો. અધિકૃત અધિકારી યુનીયન બેંક ઓફ ઈન્ડિયા તારીખ : ૦७.૦७.૨૦૨૦ સ્થળ : વાપી

જાહેર નિવિદા એસકે / ર સને ૨૦૨૦-૨૧

કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત (મા×મ) વિભાગ, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૩૧૯૦૦ બીજા માળે, જિલ્લા પંચાયત ભવન, કોર્ટે બીલ્ડીગની પાછ<mark>ળ,</mark> જુનાથાણા, નવસારી કચેરી તથા પેટા કચેરી વિભાગ માટે ઝેરોક્ષ કામ તથા કોમ્પ્યુટર પ્રિન્ટીંગ તેમજ બાઈન્ડીંગનું કામ જેના ભાવો સ્થાનિક સપ્લાયરો પાસેથી ભાવપત્રકો મંગાવવામાં આવે છે. કોરા ભાવપત્રકો રૂા. ૬૦૦ + ૨૦ ચલનથી જમા કરાવ્યેથી કોર<mark>ા</mark> ભાવપત્રકો તા.૧૩.૭.૨૦૨૦ ના રોજ ૨.૩૦ કલાક સુધી આપવામાં આવશે. જે તા.૨૧.૭.૨૦૨૦ સુધીમાં ૨જી.પો.ંએ.ડી. / સ્પીડ પોસ્ટથી સ્વીકારવામાં આવશે. અન્<mark>ય</mark> શરતો કચેરીના નોટીસ બોડૅ ઉપર જોવા મળશે. વધુ વિગતો માટે કચેરીના કામકા<mark>જ</mark> સમય દરમ્યાન સંપકૅ કરવાનો રહેશે.

> કાયૅપાલક ઈજનેર પંચાયત (મા×મ) વિભાગ નવસારી

ઓનલાઈન ટેન્ડરીંગ જિલ્લા પંચાયત ભરૂચ

જાહેર નિવિદા નં.૧.સને. ૨૦૨૦ -૨૧ હાઈમાસ્ટ ટાવર/એલ.ઈ.ડી લાઈટ

કાર્ચપાલક ઈજનેર, પંચાયત (મા.મ) વિભાગ ભરૂચ ૩૯૨ ૦૦૧ ફોન નં. (૦૨૬૪૨) ૨૪૩૪૧૫ દ્વારા નીચે જણાવેલ કામો માટે ઓનલાઈન ટેન્ડરથી ગુજરાત રાજયની માન્ય યાદીની યોગ્ય શ્રેણીમાં નોધાયેલ ઈજારદારશ્રીઓ પાસેથી એલ.ઈ.ડી લાઈટ અને હાઈમાસ્ટ ટાવર વિગેર્ટનાં ટેન્ડર માંગવામાં આવે છે. ઈ-ટેન્ડરની વિગતો અત્રેની કરોરીએ તથા વેબસાઈટ પરથી જોવા મળશે. જુલ્લા પંચાયત હસ્તકના ભરૂચ તમામ તાલુકાઓ માટે માલ-સામાન મજૂરી સહિતનાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઈ-ટેન્ડરથી જરૂરીયાત મુજબનો માલ-સામાન તેમજ મજૂરી સાથે તમામ ટેક્ષ સહિત સ્થળ બેઠાનાં આઈટમ દીઠ ભાવો મંગાવવામાં આવે છે.

9					
https:	//rnb.nprocure.com	तथा https://npro	cure.com.	www.sta	atetenders.com
11111111	,,				
પરથી જોવા મળશે.					

માહિતી/નવ/૧૨૭/૨૦૨૦

પરથા જાવા મળતા.					
अनं.	કામનું નામ	टेन्डर झीनी रङम	બાનાની રકમ		
٩	માલ-સામાન તેમજ મજુરી સહિત સ્થળ બેઠાનાં ભાવો	5800\	900000/-		
ઓન લાઈન સબમીશનની સ્ટાર્ટ તારીખ		તા. ૦૮/૦७/૨૦૨૦ સમય ૧૮:૦૦			
ઓનલાઈન સબમીશનની છેલ્લી તારીખ		તા. ૦૮/૦७/૨૦૨૦ સમય ૧૮:૦૦			
ટેન્ડર ફી બાનાની તથા અન્ય ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ થી રજુ કરવાની તારીખ		તા. ૨૫/૦७/૨૦૨૦ થી દિન-७ માં સમય ૪ : ૦૦ ક્લાક સુધી			
ટેન્ડર ઓપનીંગ તારીખ		તા. ૨૫/૦७/૨૦૨૦. સમય ૫:૦૦			
વધુ વિગતો માટે વિગતવાર નોટીસ ઉપરોક્ત વેબસાઈટ પરથી જોવા મળશે					

આજે રાજ્યમાં પ૩૬ કોરોના દર્દીઓ

કોરોનાને મહાત આપી ચુક્યા છે જેને

લઈને કોરોનાના કુલ ડિસ્ચાર્જનો આંકડો

નં. પી.આર.ઓ./૨૮૮/૨૦૨૦-૨૧

di. 00/00/2050

(નિચમ ૮(૧) જુઓ)

મેળવી શકો છો.

स्थल : सुरत

સ્થળ : સુરત

તારીખઃ જુલાઈ ૦૬, ૨૦૨૦

વારીમઃ ૦૪/૦७/૨૦૨૦

ક્શળ : ભિસ્તાનુક

માહિવી/ભરૂચ/૧७६/૨૦૨૦-૨૧

તારીખ : 03.06.૨0૨0

તાલુકા–કામરેજ, જિ. સુરત ખાતે આવેલ મિલકત.

પરિણામો પર ચર્ચા કરવા અને મંજૂરી માટે મળશે.

સુરેન્દ્રનગરમાં ૧૧-૧૧, આણંદ અને

જામનગરમાં ૧૦-૧૦, મહીસાગર ૭,

અમરેલી અને દાહોદમાં ૬-૬, પાટણ

અને મોરબીમાં ૫-૫, અરવલ્લી અને

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સતત છેલ્લા સાત દિવસથી ગુજરાતમાં અમદાવાદમાં ૧૮૭, વડોદરામાં ૬૮,

કોરોનાના કેસ રોજરોજ નવો વિક્રમ રાજકોટમાં ૪૦, ભાવનગર અને

નોંધાવે છે. છેલ્લા ૨૪ કલાક દરમયાિન વલસાડમાં ૨૧-૨૧, ગાંધીનગરમાં

રાજ્યમાં કોરોનાના ૨૨ દર્દીઓના મૃત્યુ ૧૮, મહેસાણા અને ભરૂચમાં ૧૫-૧૫,

થવા પામ્યા છે. જેને લઈને રાજ્યમાં કુલ કચ્છમાં ૧૪, જુનાગઢ અને નવસારીમાં મૃત્યુ આંક ૨૦૫૨ થયો છે. બીજી બોજુ ૧૩-૧૩, બનાસકાંઠા ૧૨ ખેડા અને

સુરત મહાનગરપાલિકા

જાહેર અપીલ (COVID-19)

• જો કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ કે કોરોના

● ધનવંતરી રથમાં મળતી પ્રાથમિક સારવારનો/ઈમ્ચુનીટી બુસ્ટર ઓષધીઓનો લાભ લો

• શરદી , ખાંસી , તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો નજીકના હેલ્થ સેન્ટર / ફેમીર્લ

• સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના સંક્રમિત વ્યક્તિઓ હોમબેઝ આઈસોલેશન અને

🗨 જે વ્યક્તિ કોરોનાની બીમારીથી સાજા થયેલ છે, તે પૈકી કોઈ વ્યક્તિ પ્લાઝમા

ડોનેટ કરવા ઈચ્છા ધરાવતા હોય, તો સ્મીમેર બ્લડ બેંક (નં.૯७२७७४०૯૨૯

૯७२७७४०६३०) નો સંપર્ક કરવા અને જો કોઈ વ્યક્તિ સુરત મહાનગરપાલિકાર્ન

હોસ્પિટલ કે કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર ખાતે વોલન્ટીયર તરીકે સેવા આપવા

માંગતા હોય, તેમણે ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૨૩-૮૦૦૦ પર સંપર્ક કરવા જણાવવામ

सेन्ट्रल બેંક ઓફ ઇન્ડિયા

सेन्ट्रल बेंक ऑफ इंडिया

Central Bank of Ìndia

રૂસ્તમપુરા શાખા : ૧૩७, વાડી મહોલ્લો રોડ, રૂસ્તમપુરા,

सुरत-उल्प ००२. (गुજरात) ● क्रीन : ०२५९-२३२५७०६, २३५५३५८

પઝેશન નોટીસ

અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ

એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ (ઓર્ડર 3 ઓક ૨૦૦૨) તથા કલમે ૧૩(૧૨)

હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ સાથે

વંચાણે લેતા અંતર્ગત **તા.૦૨.૦૧.૨૦૨૦** ના રોજ ૧૩(૨)ની ડિમાન્ડ નોટીસ દ્વારા

ઉધારકર્તા/કરજદાર <mark>શ્રી પ્રવિણભાઈ અરજણભાઈ સાંગાણી (કરજદાર) અને શ્રી ધર્મે</mark>ન્દ્ર પ્ર<mark>વિણભા</mark>દ

સાંગાણી (સહ-કરજદાર) અને જામીનદાર શ્રી પ્રકાશભાઈ પરષોત્તમભાઈ વઘાસીયા ને નોટીસમ

જણાવેલ ૨કમ **રૂા. ૧७,૬૩,७४४/- (રૂા. સતર લાખ ત્રેસઠ હજાર સાતસો ચુંબાલીસ પુરા**) ચડત

નથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ કાયદા કલમ ૧૩ (૪) તથા નિયમ ૮ અને

. હેઠળ મળેલ સત્તાની રૂએ **તા. ૦૩.૦७.૨૦૨૦**ના રોજ નીચે જણાવેલ મિલકતનો **સાંકેતિક કબજો** લઈ

છે કે નીચે દર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં અને મિલકતનો સોદો કરશે તો તે **સેન્ટલ બેંક ઓ**ક

ઈન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરતના બાકી લેણા રૂા. ૧७,૬૩,७४४/- (રૂા. સતર લાખ ત્રેસઠ હજાર સાતસે

ચુંબાલીસ પુરા) તા. ૦૨.૦૧.૨૦૨૦ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ખર્ચા ને આધિન રહેશે.

ઉદ્યારકર્તા/જામીનદારને ઉપરોક્ત રકમ ચૂકવવામાં કસૂરવાર થતાં આથી ઉદ્યારકર્તા/જામીનદાર

ઉદ્યારકર્તા/સિક્યોર્ડ ડેબ્ટર/જામીનદારને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને સૂચિત કરવામાં આવે

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં સેક્સન ૧૩ના

નબ સેક્શન (૮) સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી

स्थावर भिલકतनी विगत

રહેઠાણ લાયક મિલકત જે સ્થિત છે પ્લોટ નં. ૧૮૮, "રામ વાટીકા વિભાગ–૨", ગામ–વેલંજા

કોર્પોરેટ ઓફિસ: ૩જો માળ, દાવર ચેમ્બર્સ, સબજેલ નજીક, રિંગરોડ, સુરત-૩૯૫૦૦૨.

ટેલી નં. +૯૧-૨૬૧-૪૧૯૦૨૦૦ **ફેસઃ** +૯૧-૨૬૧-૨૬૩ ૫૫૫૦ **E-mail:** info@shahlon.com

Website: www.shahlon.com | CIN: L17120GJ2008PLC053464

नोटिस

રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૭ની સાથે રેગ્યુલેશન ૨૯ અને ૩૩ અન્વયે

શનિવાર, ૧૧ જુલાઈ, ૨૦૨૦ નાં રોજ કંપનીના બોર્ડ ઓફ્ર ડાયરેક્ટર્સની મિટિંગ કંપનીની કોર્પોરે<mark>ટ</mark>

ઓફિસ, ૩જા માળે, દાવર ચેમ્બર્સ, સબજેલ નજીક, રિંગરોડ, સુરત–૩૯૫૦૦૨ ખાતે,

કંપનીના ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થતા ત્રિમાસીક અને વાર્ષિક ગાળાના ઓડિટેડ નાણાંકિ<mark>ય</mark>

વધ વિગત કંપનીની વેબસાઈટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ

www.bseindia.com કે જ્યાં કંપનીના ઈક્વીટિ શેરો લિસ્ટેડ છે, તેના પર ઉપલબ્ધ છે.

દબાણગુરત આરિત વસૂલી શાખા, સુરત શહેર ક્ષેત્ર,પ્લોટ નં.ક-બી, ત્રીજો માળ, બરોડા સન કોમ્પલેસ, ઘોડદોડ રોડ,સુરત-૩૯૫૦૦૦ ફોન નં. ૦૨૬૧-૨૨૯૪૩૦૧/૩૦૨ ઇમેઇલ: sarsuc@bankofbaroda.com

કબજા નોટીસ (સ્થાવર મિલકત)

આથી નીચે સહી કરનારની બેંક ઓફ બરોડા, ના અધિકૃત અધિકારી હોવાર્થ

સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ

સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સીક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની

કલમ ૧૩ને સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તારીખ ૨૩/૧૧/૨૦૧૮ ના રોજ કલમ ૧૩ને સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તારીખ ૨૩/૧૧/૨૦૧૮ ના રોજ કરજદાર/જામીનદાર/મોર્ગેજર મેસર્સ મમતા મહલ, શ્રીમતી મમતા મનીષ ગુલગુલીયા, શ્રીમતી મામોલ દેવી આનંદમલ ગુલગુલીયા, શ્રી મનીષ આનંદમલ ગુલગુલીયા, શ્રી કમલેશ આનંદમલ ગુલગુલીયા, શ્રી સંદિપ આનંદમલ ગુલગુલીયા, શ્રી પવન આનંદમલ ગુલગુલીયા ને ડીમાન્ડ નોટીસ પાઠવી હતી. સદર નોટીસમાં દર્શાવેલી રકમ રૂા.પ૮,૧૨,૯૩૬/–(રૂપિયા અર્કાવન લાખ

બાર હજાર નવસો છત્રીસ પુરા) (તા. ૩૧/૧૦/૨૦૧૮ ના રોજ સુધીના વ્યાજ સહિત) અને ૦૧/૧૧/૨૦૧૮ થી લાગુ વ્યાજ સહિતની સ્કમ સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં

પરંત ચુકવવા જણાવ્યું હતું. કરજદાર/જામીનદાર/મોર્ગેજર સદરહું રકમ પરંત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર/જામીનદાર/મોર્ગેજર અને જાહેર જનતા ને આ સાથે નોટીસ આપવામાં આવે છે કે નીચે

સહી કરનારે સદરહુ કાયદાની કલમ ૧૩ (૪) ના નિયમ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અર્હ

ખાસ કરીને કરજદાર/જામીનદાર/મોર્ગેજર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવર્ણ

ઝાપવામાં આવે છે કે તેમણે સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહી અને કોઈપણ

વ્યવહાર બેંક ઓફ બરોડા માટે રૂં1.૬७,૪૧,૧૩૬.૪७ (રૂપિયા સર્ડેસઠ લાખ એક્તાલીસ હજાર એક્સો છત્રીસ અને સુકતાલીસ પૈસા) જે તા.૩૦/૦૬/૨૦૨૦ ના રોજના અને ૦૧/૦७/૨૦૨૦ થી

લાગુ વ્યાજ સહિતની રકમ અને સંપૂર્ણ વસુલાત સુધીના ખર્ચા ની રકમ વસુલાતને પાત્ર રહેશે. અહીં કરજદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્યાદામાં સેક્શન ૧૩ના સબ્-સ્કેકશન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બ્રાકી લેણા ભરપાઇ કરી પાછી મેળવી

ઃ સ્થાવર મિલકતનું વર્ણન ઃ

ઈકવીટેબલ મોર્ગેજ મિલકત જે સ્થિત વોર્ડ નં.૧૯, પુરાની લાઈન, ગંગાશાહર બિકાનેર

અને જે શ્રીમતી મામોલ દેવી આનંદમલ ગુલગુલીચાના નામની મિલકત જેની ચતુઃદિશા– ઉત્તરે : શ્રી રતન લાલ, દક્ષિણે : રસ્તો, પૂર્વે : શ્રી શાંતીલાલ, પશ્ચિમે : રસ્તો.

નીચે જણાવેલી મિલકતોનો કબજો તારીખ ૦૪/૦७/૨૦૨૦ના દિને સંભાળી લીદોલ છે.

આથી નોટિસ આપવામાં આવે છે કે સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસક્લોઝર

વ્યાજના નોટીસ મુજબ. નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

નીચે સહી કરનાર **સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરત**ના અધિકૃત

ફીઝીશ્ચનનો સંપર્ક કરવો અથવા આરોગ્ય હેલ્પ લાઈન નં.૧૦૪ નો સંપર્ક કરવો

બિમારી જેવા કોઈ લક્ષણ જણાય તો તુરંતજ ધનવંતરી રથનો સંપર્ક કરવો.

માટે નીચે જણાવેલ સુચન ધ્યાને લેવા અપીલ કરવામાં આવે છે.

ટ્રીટમેન્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે એ ખુબ જ જરૂરી છે.

સુરત શહેરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને અટકાવવા

૭૭૪ કોરોના પોઝિટિવના કેસ નોંધાવા તમામ પોકળ સાબિત થયા છે. આજે પામ્યા છે. અર્થાત ગુજરાતમાં શહેરો કરતા ૭ મૃત્યુ નોંધાતા અમદાવાદનો મૃત્યુઆંક વેન્ટિલે-ટર પર અને ૮૮૫૨ સ્ટેબલ છે. ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળ છે.

દિવસેને દિવસે નવા દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારોઃ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૩૮

હજારને વટાવી ૩૮૦૭૮ અને મરણાંક ૨૦૫૨ ઉપર પહોંચ્યોઃ વધુ ૫૩૬ સહિત અત્યાર સુધી ૨૬૯૯૧ વ્યક્તિઓ કોરોનાને મહાત આપીને સારા થઈ ગયાંઃ હજુ ૯૦૩૩ સારવાર હેઠળ

પામ્યા છે. તેને લઈને ગુજરાતમાં કુલ પણ ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધતું ૧૫૦૦ નજીક અર્થાત ૧૪૯૮ થયો છે. ૨૫જયમાં

કોરોના પોઝિટિવિ કેસ ૩૮ હજારને કેસ નોંધવા પામ્યા છે. સુરતમાં આજે જાય છે તેમ છતાં પણ આરોગ્ય વિભાગ જ્યારે સુરતમાં ૧૧ મૃત્યુ થવાને લઈને ત મ ા મ

સતત વધી રહેલા કેસોને

પગલે જોખમી થઇ રહેલા

ક્લસ્ટર કરવામાં આવે

છે. લીંબાયત વિસ્તારમાં

લોકોને પણ ક્લસ્ટર હેઠળ =

મુકવામાં આવ્યા છે.

પાર કરીને ૩૮૦૭૮ થવા પામ્યા છે. ૨૪૫ કેસ નોંધાવા પામ્યો છે. જ્યારે તેને ડામવા માટે નિષ્ફળ પુરવાર થયું છે. સુરતનો મૃત્યુઆંક ૨૭૦ થયો છે.

સુરત, તા. ૭ રોડ, નંદનવન સોસાયટી, કાપોદ્રાની રચના

હેઠળ મુકવામાં આવ્યા છે.

આનંદનગર ઝુંપડપટ્ટી,

ચાલ, સ્મીમેર હોસ્પિટલ

સામેના રોડ પર આવેલ ૧૫ જેટલા મકાનો,

જયારે લીંબાયત ઝોન

ઝુંપડપટ્ટી,

આજે મનપા કમિશ્નરે જાહેર કરેલા અને કમલપાર્ક સોસાયટી, અંકુર સોસાયટી,

નવા ક્લસ્ટરમાં વરાછા એ ઝોનમાં ૧૯૫૧૯ રચના સર્કલ નજીક આવેલા જનતા એપાર્ટમેન્ટ,

ઘરોના ૧,૨૮,૬૨૩ લોકોને ફરજીયાત હોમ યમુનાકુંજ સોસાયટી સહિતના અંદાજે ૧૯૫૧૯

ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોનાના ઘરોમાં રહેતા ૧,૨૮,૬૨૩ લોકોને ક્લસ્ટર

વરાછા-એ ઝોનના

વિસ્તારોમાં મનપા દ્વારા ૧૯૫૧૯ અને લિંબાયતના વિસ્તારમાં આવેલ સોનિયા

८०० घरने असस्टर

પણ ૯૦૪ ઘરોના ૪૨૯૪ વિસ્તારમાં મુકવામાં આવ્યા સાકાર એપાર્ટમેન્ટ, મેઘાણી

ગુજરાતમાં આજે પણ કોરોના દરમિયાન રોજેરોજ કોરોનાના પોઝિટિવ અને વાપીમાં ૩-૩, સાબરકાંઠા અને ગુજરાતમાં કોરોનાના ૨૨ દર્દીના મોત રાજ્યમાં કુલ ૭૩૬૬ લેબોરીટરી ટેસ્ટ સંખ્યામાં વધારો થતો રહ્યો છે. સંક્રમતિના કેસો સૌરાષ્ટ્ર સહિત સુરત કેસ રેકોર્ડ તોડે છે. આજે પણ વિતેલા ૨૪ છોટાઉદેપુરમાં ૨-૨ જ્યારે નર્મદા-બોટાદ થવા પામ્યા છે. જેમાં સૌથી વધુ સુરતમાં કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં આજની તારીખ કુલ ૨,૭૭,૦૬૪ અને વડોદરામાં રોજેરોજ નવી ઉચાઈ કલાક દરમયાિન કોરોનાના પોઝિટિવ અને દેવભૂમિ દ્વારકામાં ૧-૧ કેસ નોંધાવા ૧૧, અમદાવાદમાં ૭, અરવલ્લીમાં ૨ અત્યાર સુધી ૪૨૫૮૩૦ લેબોરેટરી ટેસ્ટ વ્યક્તિઓ ક્વોરોન્ટાઈન હેઠળ છે પ્રાપ્ત કરવાની હોય તેમ હરીફાઈ કરતા 🛮 કેસ ૭૭૪ નોંધાવા પામ્યા છે. આરોગ્ય પામ્યા છે. આજે પણ ગુજરામાં ૩૧ જ્યારે બનાસકાંઠા અને ખેડામાં ૧-૧ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ જેમાંથી ૨,૭૩,૬૮૪ વ્યક્તિઓ હોમ રહ્યા છે. વિતેલા ૨૪ કલાક દરમિયાન વિભાગના દાવા સહિત સરકારના દાવા જિલ્લામાં કોરોના સંક્રમતિના કેસ નોંધાવા મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં આજે ૯૦૩૩ એક્ટિવ કેસ છે જેમાંથી ૬૧ ક્વોરોન્ટાઈન અને ૩૩૮૦ વ્યક્તિઓ

SARLA PERFORMANCE FIBERS LIMITED

CIN: L31909DN1993PLC000056
Regd. Office: Survey No. 59/1/4, Amli Piparia Industrial Estate,
Silvassa- 396 230, (U.T. of Dadra & Nagar Haveli). Tel: 022 22834116, Fax: 022 22851728, Website: www.sarlafibers.com Email: info@sarlafibers.com

NOTICE TO THE SHARES HOLDER Transfer of Equity Shares and Unclaimed Dividend to Investor

Education and Protection Fund (IEPF) Account.

The Notice is published in pursuance to the provision of the Companies Act (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended of modified and various circulars issued thereto from time to time ("the Rules") notified by the Ministry of Corporate Affairs. Provisions of Section 124(6) of the Companies Act, 2013 read with IEPF Rules, inter alia provides to transfer such shares, in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund ("IEPF") Authority, set up by the Central Government. Notice is furthe given that in accordance with the provisions of the IEPF Rules, individua notices have already been sent to respective shareholders whose shares are liable to be transferred to IEPF, whose E-mail ID's are available in the Company's Registrar and Share Transfer Agent ("RTA") records, Also, the Company has uploaded the details of such shareholders and shares due for transfer to IEPF on the website at https://www.sarlafibers.com/shares-in-iepf/ In view of the current situation of global pandemic of COVID-19 and the consequen

lockdown imposed in the Country, serving physical notices to the shareholders whose E-mail ID's are not available with the Company RTA records, is challenging. Therefore, this newspaper notice may be considered as ar individual notice to such shareholders in compliance with the IEPF Rules However, for the benefits of the shareholders, individual communication shall be made once the normalcy is restored.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the origina share certificate(s) held by them for the purpose of transfer of shares to IEPF Authority as per the Rules and upon such issue the original share certificate(s) which is registered in their name shall stand automatically cancelled and be deemed non-negotiable. In case of shares held in Demat mode, the shares shall be transferred directly to IEPF Authority through the Depository Participants as per the Rules. It may be noted that the shares transferred to IEPF Authority including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority after following the procedure prescribed under the Rules or by visiting website of IEPF Authority i.e. **www.iepf.gov.in**

The shareholders may further please note that the details uploaded by the Company on its website shall be regarded as deemed adequate notice in respec of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the aforesaid Rules

વરાછા એ ઝોનમાં માર્તિ કોમ્પ્લેક્સ, વર્ષા હળપતિવાસ, સ્મીમેર હોસ્પિટલ સામેની Notice is hereby given to all the concerned shareholders to claim the unpaid unclaimed dividend amount(s) for the year 2012 -13 by making an application સોસાયટી, માતાવાડી, લક્ષ્મીનગર, સ્વસ્તિક ઝુંપડપટ્ટી, એમ.જી. ફ્રુટ માર્કેટ અને આસપાસના to the Company/Company's RTA: M/s. Sharex Dynamic India Private Limited નગર, ત્રિકમનગર-૨, લંબે હનુમાન રોડ વિસ્તારના કુલ ૯૦૪ ઘરોમાં રહેતા અંદાજે on or before 13th November, 2020, so that the shares are not transferred to the IEPF Authority. In case the Company does not receive any communication from the concerned shareholders on or before 13th November, 2020, the ઉપરાંત, ઈશ્વરકૃપા સોસાયટી, સ્પીનીંગ મિલ ૪૨૯૪ લોકોને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ હેઠળ Company shall, with a view of complying with the requirements set out in the નજીક સાગર સોસાયટી, અર્ચના સ્કુલ નજીક મુકીને નવો આદેશ ન મળે ત્યાં સુધી ફરજીયાત Rules, transfer the shares to the IEPF Authority by the due date and as per procedure stipulated in the Rules.

For any clarification on the subject matter, please contact the Company's RTA M/s. Sharex Dynamic India Private Limited, Unit: Sarla Performance Fibers Limited Address: 304, Arcadia, Nariman Point, Mumbai - 400021

For Sarla Performance Fibers Limited

Mahendra Sheth **CFO & Company Secretary**

ચાલુ કરજે જન્મદિવ્સની ઉજવણી કરતા TRB-11 12 જવાનોને છુટા કરી દેવાયા Place: Mumbai Date: 7th July, સુરતઃ પુષા વિસ્તારની સીતાનગર

સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટથી પુષાગામ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ચોકડી પાસે બ્રિજ નીચે ટ્રાફ્રિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતાં પૈકીના ટ્રાફિક બ્રિગેડની લેડી વૈશાલી નો ગઇકાલે બર્થડે હોવાથી કેક કાપીને ઉજવણી કરી હતી. કોરોના મહામારી વચ્ચે જાહેર સ્થળે કેક કાપી એ સમયે ટ્રાફ્રિક બ્રિગેડના રીજીયન - ૨માં ફરજ બજાવતી વૈશાલી, ચેતના, જાગૃતિ, જયા, હિના, અરૂણા, ફિલીપ, પરમેશ, ધર્મેશ, સંતોષ, ચિરાગ, છલય બિહારી જોડાયા હતા. જાહેરનામાનો ભંગ કરવા બદલ પુષા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

ઓન લાઇન ટેન્ડરીંગ માર્ગ અને મકાન વિભાગ જાહેર નિવિદા ને - ૦૩ સને ૨૦૨૦-૨૧, ગુજરાત સરકાર ગુજરાત રાજચના રાજ્યપાલશ્રીના વતી કાર્યપાલક ઇજનેરશ્રી, રાજપીપલા (મા.મ) વિભાગ, રાજપીપલા જિ. નર્મદા ફોન ગ્રેક્ફું<mark>૦</mark>૨૨૨૯૩૯ દ્વારા અનું.નં. ૦૧ માટે યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઇજાદારો પાસેથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ઓન લાઇન ટેન્ડર માંગવામાં આવેલ છે. જેની અંદાજીત કિંમત દ્.૩૦ લાખ છે.

પ્રસ્તુત કામના ટેન્ડર ડોક્યુમેન્ટ વેબસાઇટ https://nb.nprocure.com થતા માહિતી વિભાગ સાઇટ www.statetenders com પરથી અનું નં.૧ નું કામ તા.૧૫/૦૯/૨૦૨૦ ના રોજ ૧૮.૦૦ કલાક સુધી ઉપલ્બધ કરવામાં આવશે. ટેન્ડર ફીના ડી.ડી અને ગાનાની રકમની એફ ડી / બાના મુક્તિ પ્રમાણપત્ર તેમજ નોંધણી પ્રમાણપત્ર બેન્ક સોલવન્સી વગેરે ઓનલાઇન ફોર્મેટ માં (પ્લેન मोडलवाना रहेशे अने अनुं नं. ०९ ना डाम ना डोड्युमेन्ट टेन्डर झीना डी.डी अने जानानी रङमनी એફ.डी. /जानामुडिट પ્રમાણપત્ર તેમજ નોંધણી પ્રમાણપત્ર બેન્ક સોલવન્સી વર્ગેર તા.૧૬/૦૯/૨૦૨૦ થી તા.૨૨/૦૯/૨૦૨૦ ના રોજ ૧૬.૦૦ કલાક સુધી ૨જી.પી.એડી સ્પીડ પોસ્ટ થી કાર્ચપાલક ઇજને૨શ્રી, રાજપીપલા (મા.મ) વિભાગ, રાજપીપલાની કચેરીએ મોકલી આપવાના ૨હેશે ઇ-ટેન્ડર નોટિસ ના અ.નું ૫,૧ થી ૫.૫ મુજબ ના દસ્તાવેજ સ્કેન કરીને રજુ કરવામાં નહી આવે તો તેવા ટેન્ડરો નોન રીસ્પોન્સીવ ગણવામાં આવશે. ટેન્ડર ફી તેમજ બાનાની રકમ નિયત સમયમાં ઇજાદારશ્રી દ્વારા ભરી સાદર કરવામાં નહી આવે તો ઇજાદારશ્રીની નોંધણી એક વર્ષ માટે અબેન્સ માં રાખવામાંની કાર્યાવાહી કરવામાં આવશે તથા ઇ-ટેન્ડરીંગ નો કોડ એક વર્ષ માટે રદ કરાશે. વધુ માહિતી માટે વિગતવાર નોટીસ ઉપરોક્ત વેબસાઈટ જોવા મળશે માહિતી/નર્મદા/૧૦૫/૨૦૨૦-૨૧

सेन्ट्रल जेंड ओड़ छन्डिया Central Bank of India

રૂસ્તમપુરા શાખા : ૧૩७, વાડી મહોલ્લો રોડ, રૂસ્તમપુરા, सुरत-उद्धप ००२. (गुજरात) 🌘 झोन : ०२५१-२३२५७०६, २३५५३५८

પઝેશન નોટીસ

અધિકૃત અધિકારી,

સેન્ટલ બેંક ઓફ ઈન્ડિય

शाहलोन सिल्ड ईन्डस्ट्रीप्र लि. ना

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી પ્રાપ્ત સત્તાની રૂએ

હિતેશ કે. ગરમોરા (કંપની સેકેટરી)

નીચે સહી કરનાર **સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરત**ના અધિકૃત ખધિકારીએ સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (ઓર્ડર 3 ઓફ ૨૦૦૨) તથા કલમે ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ સાથે વંચાણે લેતા અંતર્ગત તા.૦૨.૦૧.૨૦૨૦ ના રોજ ૧૩(૨)ની ડિમાન્ડ નોટીસ દ્વાર ઉધારકર્તા/કરજદાર શ્રી અશોકક્રમાર ગોરધનભાઈ ડોબરીયા અને શ્રીમતી નિર્મલાબેન ગોરધનભાઈ કોબરીયાને નોટીસમાં જણાવેલ ૨કમ રૂા. ૧૫,૪૫,૦૮७/- (રૂા. પંદર લાખ <mark>ાીસતાલીસ હજાર સિત્યાસી પુરા)</mark> ચડત વ્યાજના નોટીસ મુજબ. નોટીસ મળ્યાના ૬૦ દિવસમ ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

ું ઉદ્યારકર્તા/જામીનદારને ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉદ્યારકર્તા/જામીનદાર તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ કાયદા કલમ ૧૩ (૪) તથા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલ સત્તાની રૂએ **તા. ૦૩.૦७.૨૦૨૦**ના રોજ નીચે જણાવેલ મિલકતનો **સાંકેતિક કબજો** લ

ઉદ્યારકર્તા/સિકયોર્ડ ડેબ્ટર/જામીનદારને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને સુચિત કરવામાં આ છે કે નીચે દર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં અને મિલકતનો સોદો કરશે તો તે **રોન્ટ્રલ બેંક ઓફ** <mark>ઇન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરત</mark>ના બાકી લેણા <mark>રૂા. ૧૫,૪૫,૦૮७/- (રૂા. પંદર લાખ પીસતાલીસ હ</mark>જા **સિત્યાસી પુરા)** તા. ૦૨.૦૧.૨૦૨૦ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ખર્ચા ને આધિન રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં સેક્સન ૧૩ન સબ સેક્શન (૮) સરકેસી એકટ ઢેઠળ તમો તમારી સરક્ષિત મિલકતના બાકી લ્ઢેણાં ભરપાઈ કરી પાછે

स्थावर भिलङतनी विगत **૨**હેઠાણ લાચક મિલકત જે સ્થિત છે પ્લોટ નં. ૨૧૫, "શુભ નંદની રેસીડેન્સી–૨", ગામ-

કામરેજ, તાલુકા–કામરેજ, જિ. સુરત ખાતે આવેલ મિલકત. અધિકૃત અધિકારી તારીખ : ૦૩.૦७.૨૦૨૦ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિર સ્થળ : સુરત

्री वैक ऑफ़ बड़ोदा Bank of B દભાષાગરત આરિત વસૂલી શાખા, સુરત શહેર ક્ષેત્ર,પ્લોટ નં.ક-બી, ત્રીજો માળ, બરોડા સન કોમ્પલેસ, ઘોડદોડ રોડ,સુરત-૩૯૫૦૦७. ફોન નં.૦૨૬૧–૨૨૯૪૩૦૧/૩૦૨ ઇમેઇલ: Sarsuc@bankofbaroda.com કબજા નોટીસ (સ્થાવર મિલકત)

આથી નીચે સહી કરનારની બેંક ઓફ બરોડા, ના અધિકૃત અધિકારી હોવાથી સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની કલમ ૧૩ને સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તારીખ ૨૩/૧૧/૨૦૧૮ ના રો૧ કરજદાર/જામીનદાર/મોર્ગેજર મેસર્સ મનીષ ફેબ, શ્રી મનીષ આનંદમલ ગુલગુલીયા અને તેન જામીનદાર શ્રીમતી મામોલ દેવી આનંદમલ ગુલગુલીચા, શ્રીમતી મમતા મનીષ ગુલગુલીચા, શ્રી કમલેશ આનંદમલ ગુલગુલીચા, શ્રી ૫વન આનંદમલ ગુલગુલીચા, શ્રી સંદિપ આનંદમલ ગુલગુલીચા ને ડીમાન્ડ નોટીસ પાઠવી હતી. સદર નોટીસમાં દર્શાવેલી રકમ રૂા.૫૬,૩૬,૯૮૯/– રૂપિયા છપ્પન લાખ છત્રીસ હજાર નવસો નેવ્યાસી પુરા) જે તા. ૩૧/૧૦/૨૦૧૮ ના રોજ સુધીન અને ૦૧/૧૧/૨૦૧૮ થી લાગુ ભવિષ્યાના વ્યાજ સહિતની ૨કમ સદરહુ નોટીસ મળ્યાની

તારીખથી ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું. કરજદાર/જામીનદાર/મોર્ગેજર સદરહું રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર/જામીનદાર/મોર્ગેજર અને જાહેર જનતા ને આ સાથે નોટીસ આપવામાં આવે છે કે નીચે હી કરનારે સદરહુ કાયદાની કલમ ૧૩ (૪) ના નિયમ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી

ખાસ કરીને કરજદાર/જામીનદાર/મોર્ગેજર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવર્ણ ાપવામાં આવે છે કે તેમણે સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહી અને કોઈપણ વ્યવહાર બેંક ઓફ બરોડા માટે રૂા.ંક્ક,હ્રક,૧૩૮.પર (રૂપિયા છાસઠ લાખ છોતેર હુજાર એકસે આડત્રીસ અને બાવન પૈસા) જે તા.૩૦/૦૬/૨૦૨૦ ના રોજના અને ૦૧/૦૯/૨૦૨૦ થી લાગ્ વ્યાજ સહિતની રકમ અને સંપૂર્ણ વસૂલાત સુધીના ખર્ચા ની રકમ વસુલાતને પાત્ર રહેશે. અહીં કરજદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્ચાદામાં સેક્શન ૧૩ના સબ્–સેક્શન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેણા ભરપાઈ કરી પાછી મેળવી

ઃ સ્થાવર મિલકતનું વર્ણન ઃ એકટેક્ષન થયેલ ઈકવીટેબલ મોર્ગેજ મિલકત જે સ્થિત વોર્ડ નં.૧૯, પુરાની લાઈન, ઝાંગશાહિર બિકાનેર અને જે શ્રીમતી મામોલ દેવી આનંદમલ ગુલગુલીયાના નામની મિલકત જેની ચતુઃદિશા– ઉત્તરે : શ્રી રતન લાલ, દક્ષિણે : રસ્તો, પૂર્વે : શ્રી શાંતીલાલ, પશ્ચિમે : રસ્તો-

નીચે જણાવેલી મિલંકતોનો કબજો તારીખ ૦૪/૦७/૨૦૨૦ના દિને સંભાળી લીદોલ છે.

તારીમઃ o४/o७/૨o૨o અધિકૃત અધિકારી અને મુખ્ય પ્રબંધક, ક્શળ : બિસ્નોનેક બુંસ્ ઓર્સ ભકારા

सेन्ट्रल બेंક ઓફ ઇન્ડિયા **Central Bank of India** રૂસ્તમપુરા શાખા : ૧૩७, વાડી મહોલ્લો રોડ, રૂસ્તમપુરા,

सुरत-उल्प ००२. (गुજरात) ● क्रोन : ०२९१-२३२५७०६, २३५५३९८

પઝેશન નોટીસ

નીચે સહી કરનાર **સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરત**ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓક કાયનાન્સિયલ એસેટસ એન્ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (ઓર્ડર 3 ઓફ ૨૦૦૨) તથા કલમે ૧૩(૧૨) કેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ તથા નિયમ ૩ સાથે વંચાણે લેતા અંતર્ગત **તા.૦૨.૦૧.૨૦૨૦** ના રોજ ૧૩(૨)ની ડિમાન્ડ નોટીસ દ્વાર ઉધારકર્તા/કરજદાર <mark>શ્રી મૌલીકકુમાર ભરતભાઇ બુટાણી અને શ્રી ભરતભાઇ પોપટભાઇ બુટાણી</mark> ને નોટીસમાં જણાવેલ ૨કમ **રૂા. ૧૫,૦૨,૮૮૬/- (રૂા. પંદર લાખ બે હજાર આઠસો છચાસી પુરા**) યડત વ્યાજના નોટીસ મુજબ. નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

ઉધારકર્તા/જામીનદારને ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આર્થ ઉદ્યારકર્તા/જામીનદાર તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ કાયદા કલમ ૧૩ (૪) તથા નિયમ ૮ અને ૯ હેઠળ મળેલ સત્તાની રૂએ **તા. ૦૩.૦७.૨૦૨૦**ના રોજ નીચે જણાવેલ ાલકતનો **સાંકેતિક કબજો** લઈ લીધેલ છે.

ઉદ્યારકર્તા/સિકચોર્ડ ડેબ્ટર/જામીનદારને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને સુચિત કરવામાં ાવે છે કે નીચે દર્શાવેલ મિલકતનો સોદો કરવો નહીં અને મિલકતનો સોદો કરશે તો તે **સેન્ટ્રલ બેંક** <mark>ઓફ ઇન્ડિયા, રસ્તમપુરા શાખા, સુરત</mark>ના બાકી લેણા <mark>રૂરા. ૧૫,૦૨,૮૮૬/- (રૂા. પંદર લાખ બે હજાર</mark> **માઠસો છ્યાસી પરા)** તા. ૦૨.૦૧.૨૦૨૦ના રોજ થી ચડત વ્યાજ અને અન્ય ખર્ચા ને આધિન રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં સેક્સન .૩ના સબ સેક્શન (૮) ^{*}સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી

પાછી મેળવી શકો છો.

સ્થાવર મિલકતની વિગત રહેઠાણ લાચક મિલકત જે સ્થિત છે પ્લોટ નં. ૧૫૧, "સહજાનંદ રેસીડેન્સી", ગામ–કોળં

ભરથાણા, તાલુકા–કામરેજ, જિ. સુરત ખાતે આવેલ મિલકત.

તારીખ : ૦૩.૦૯.૨૦૨૦ સ્થળ : સુરત

અધિકૃત અધિકારી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિય

्री बैंक ऑफ़ बड़ौदा Raph of D

નાના વરાછા રોડ શાખા, ૧૨७, શ્રેયસ ડાયમંડ સેન્ટર, નાના વરાછા રોડ, સુરત-૩૯૫૦૦૬, ફોન:૦૨૬૧-૨૫૪७૩७૯. fbaroda.com

કબજા નોટીસ (સ્થાવર મિલકત) આથી નીચે સહી કરનારની બેંક ઓફ બરોડા, ના અધિકૃત અધિકારી હોવાથી સિકયુરિટાઈગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટરેસ્ટ

(સેકન્ડ) એક્ટ, ૨૦૦૨ એને સીકયુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) ા રૂર્લ્સ ૩ ને સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તારીખ ૦૨/૦૩/૨૦૨૦ ના રોજ કરજદાર (૧) શ્રે અહેન્દ્રક કે લોકા વધારા મહાલા ધરાઠા ફેઇ તાલા અરાઇક સ્ટિંગ્ફ સાથે કરક દાર (૧) ત્રા મહેન્દ્રકુમાર ભાનુલાલ ખુટ (કરજદાર),(૨)શ્રીમતી શીલ્પા મહેન્દ્રકુમાર ખુટ (સહ–કરજદાર), (૩) શ્રી ચોગેશ વજલાલ રામોલીચા, (૪)શ્રી ભાવેશ ભાનુલાલ ખુટ અને (૫) શ્રી ભાનુલાલ ફુલાભાઇ ખુટ (જામીનદાર) (ખાતા ન ૧૨૨૬૫૧૦૩૨૦૧૪) ને ડીમાન્ડ નોટીસ પાઠવી હતી સદર નોટીસમાં દર્શાવેલી ૨૬મ રૂા ૨૩,૪૬,૦૦૮/–(રૂપિયા તેવીસ લાખ છેતાલીસ હજાર આઠ પુરા) સદરહું નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું. કરજદાર સદરહું રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદાર અને જાહેર જનતા ને આ સાથે નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સીકચુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ,

200રના સેક્શન ૧૩ ના સબ–સેક્શન(૪) ના નિયમ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અર્હ નીચે જણાવેલી મિલકતોનો કબજો તારીખ ૦૩/૦૯/૨૦૨૦ના દિને સંભાળી લીઘેલ છે. ખાસ કરીને કર્જદાર/જામીનદાર/મોર્ગેજર અને જાહેર જનતાને આથી જાહેર ચેતવર્ણ

ાપવામાં આવે છે કે તેમણે સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહી અને કોઈપણ વ્યવહાર બેંક ઓફ બરોડા માટે રૂ1.૨3,૪૬,૦૦૮/—(રૂપિયા તેવીસ લાખ છેતાલીસ હજાર આઠ પુરા)અને તેની ઉપર કરાર મુજબના ના દરે વ્યાજ ઉપરાંત ખર્ચ, ચાર્જીસ અને સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધીના અન્ય ખર્ચાઓ સહિતની રકમ અને સંપૂર્ણ વસૂલાત સુધીના ખર્ચા ની રકમ

વસલાતને પાત્ર રહેશે. ... એહી કરજદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્ચાદામાં સેકશન ૧૩ન મબ-સેક્શન (૮) હેઠળ તમોં તમારી સુરક્ષિત મિલક્તોને બાકી લેણા ભરપાઈ કરી પાછી મેળવી

ः स्थापर भिसङतनुं पर्शन ः તમામ ભાગ અને હિસ્સો ધરાવતી સ્થાવર મિલકત પ્લોટ નં. ૧૩૨, માપ ૧૪૮૦.૦૩ ચો.ફીટ, રામ વાટીકા બંગ્લોઝ , જે સ્થિત જમીનનો બ્લોક નં. ૨૧૪, સર્વે નં. ૧७૬ અને ૧७७ પૈકી, વેલંજા, સબ જીલ્લો કામરેજ, જીલ્લો સુરત. અને જેની ચતુઃદિશા– ઉત્તરે : પ્લોટ નં.૧૩૧, દક્ષિણે : પ્લોટ નં.૧૩૩, પૂર્વે : પ્લોટ નં.૧૨૩, પશ્ચિમે : સોસાચટીનો રસ્તો.જે શ્રી મહેન્દ્રકુમાર

માનુલાલ ખુટ અને શ્રીમતી શીલ્પા મહેન્દ્રકુમાર ખુટ (કરજદાર)ના નામની મિલકત અધિકૃત અધિકારી, વારીમઃ 03/0७/२०२० બેંક ઓફ બરોડા. स्थण : सुरत

અધિકૃત અધિકારી અને મુખ્ય પ્રબંધક, બેંક ઓફ બરોડા Frinted by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry at Guardian House, Ring Road, R

(ગોપાલ ચૌદ્યરી)

FINANCIAL EXPRESS

SHAHLON SILK INDUSTRIES LIMITED

Corporate Office: 3rd Floor, Dawer Chambers, Nr. Sub-Jail, Ring Road, Surat - 395 002 Tel No.: +91-261-4190200 Fax: +91-261-2635550 E-mail: info@shahlon.com Website: www.shahlon.com CIN: L17120GJ2008PLC053464 NOTICE

Notice is hereby given pursuant to Regulation 47 read with Regulation 29 and 33 f the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that the meeting of the Board of Directors of the Company is schedule to be held on Saturday, July 11, 2020 at the corporate office of the Company situated at 3rd Floor Dawer Chambers, Nr. Sub-Jail, Ring Road, Surat – 395002, to consider and approve nter-alia, the Audited Financial Results of the Company for the guarter and nancial year ended on 31st March, 2020. Further details are available at the website of the Company and at the website of

he Bombay stock exchange www.bseindia.com where the equity shares of the company is listed.

Under Authority of the Board of Directors of Shahlon Silk Industries Limited Sd-

Place: Surat Date: July 06, 2020

Hitesh K. Garmora Company Secretary

PUBLIC NOTICE

Form no INC-26 [Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

IN THE MATTER OF L. C. RAHEJA FOREX PRIVATE LIMITED (CIN: U65923DD2007PTC009790) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141 CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.

.....THE PETITIONER Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June 2020 to enable the Company to change its registered office from "Union territory of Damar & Diu" to "State of Gujarat".

Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below:

Regd Off.: Office no.141, Center Point, Somnath, Daman-396210, Daman & Diu

Place : Mumbai

Date : July 06, 2020

For and on behalf of Applicant For L. C. Raheja Forex Private Limited SD/ Mr. RAJENDRA D. SHAH Director DIN: 00005013

RP-Sar Group RP-Sanjiv Goenka



Regd. Office: 31, Netaji Subhas Road, Kolkata - 700001 Tele: +91 33 6625 1461 - 64, Fax: +91 33 2243 6681 Corporate Office: RPSG House, 2/4 Judges Court Road, 4th Floor, Kolkata - 700027, Tele: +91 33 4087 0500/0600 E-mail: pcbl@rpsg.in , Web: www.pcblltd.com

NOTICE OF THE 59TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

- Notice is hereby given that the Fifty Ninth Annual General Meeting (59th AGM) of the Members of the Company will be convened on Thursday, the 30th day of July, 2020 at 10:30 A.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020, respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"), without the physical presence of the Members. Pursuant to Section 91 of the Companies Act, 2013, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from the 24th day of July, 2020 to the 30th day of July, 2020 (both days
- The Notice of the 59th AGM and the Annual Report of the Company including the financial statements for the financial year ended 31st March, 2020 ("Annual Report") has been sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with the Company's Registrar and Share Transfer Agent, namely, Link Intime India Private Limited ("RTA") or with their respective Depository Participants ("Depository"), in accordance with the MCA Circular/s and the SEBI Circular. The requirements of sending physical copy of the Notice of the 59th AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circulars/s and SEBI circular.
- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut off date of 23rd July, 2020 may cast their vote electronically , as set out in the Notice of the 59th AGM through electronic voting system ("remote e-Voting") of National Securities Depository Limited (NSDL)

In line with the MCA Circulars and SEBI Circular, the Notice of the 59th AGM of

- the Company has been uploaded on the website of the Company at www.pcblltd.com. The Notice can also be accessed from the websites of the Stock Exchanges, namely, National Stock Exchange (NSE) at www.nseindia.com, Bombay Stock Exchange (BSE) at www.bseindia.com and Calcutta Stock Exchange (CSE) at www.cse-india.com respectively and the AGM Notice is also on the website of NSDL (Agency for providing the Remote e-Voting facility) at www.evoting.nsdl.com.
- . The remote e-Voting period begins on the 27th day of July, 2020 at 9:00 A.M (IST) and ends on the 29th day of July, 2020 at 5:00 P.M (IST). During this period, Members of the Company, holding shares in the physical or dematerialized form, as on the cut-off date of Thursday, the 23rd day of July, 2020, may cast their vote by remote e-voting. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently.
- Any person, who acquires shares of the Company and becomes Member of the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date i.e. Thursday, the 23rd day of July, 2020 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or kolkata@linkintime.co.in
- Members are requested to express their views/send their queries in advance mentioning their name, DP ID and Client ID number /Folio No., email ID, mobile no. at pcbl.agm2020@rpsg.in till 4 p.m. (IST) on Tuesday, 28th July, 2020. Members who would like to ask questions during the Fifty-ninth AGM of the Company need to register themselves as a speaker by sending their requests preferably along with their questions mentioning their name, DP ID and Client ID number/folio number, email id, mobile number, to the Company's email address at pcbl.agm2020@rpsg.in latest by 4 p.m. (IST) on Tuesday, 28th July, 2020.
- Members holding shares in physical form who have not registered their email addresses with the Company / Company's RTA / Depository, can get the same registered and obtain Notice of the 59th AGM of the Company along with the Annual Report for the financial year ended 31st March, 2020 and / or login details for joining the 59th AGM of the Company through VC /OAVM facility including evoting, by sending scanned copy of the following documents by email to the Company's RTA's email i.d., viz. kolkata@linkintime.co.in or Company's email i.d.,
- a.) a signed request letter mentioning your Name, Folio Number and Complete
- b.) self attested scanned copy of the PAN Card;

details of the cases are as under.

Name of Borrowers/

Co Borrowers /

Mortgagors/Guarantor

Rupesh Dattatraya Shedage

Ganesh Dattatraya Shedage

Rupesh Dattatraya Shedage

(Co-Borrower), (Loan A/c

S/o Dattatraya Shedage

S/o Dattatraya Baban

(Borrower & Mortgagor),

Shedage (Co-Borrower &

Mortgagor), Smt. Dipali

Rupesh Shedage W/o

No.): LSCKN02715-

L9001060100568873

160412223,

- c.) self attested scanned copy of any document (such as Aadhar Card, Driving License, Voter Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company.
- 9. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at or contact Mr. Amit Vishal, Senior Manager/Ms. Pallavi Mhatre, Manager, NSDL, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Lower Parel, Mumbai - 400013 at telephone no. 022- 24994360/022 24994545 or at Email id evoting@nsdl.co.in.

The afore-mentioned information is being issued for the information and benefit of all the Members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circular

Place:- Kolkata Date:-07.07.2020

Date & Amount

of 13(2)

6-Jul-18

₹ 7,98,376/-

(Rs. Seven Lac

Ninety Eight

Thousand Three

Hundred

Seventy Six

Only)

Demand Notice Possession

Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Date Of

18-Mar-

2020

For Phillips Carbon Black Limited Kaushik Mukherjee Company Secretary

CENTRAL RAILWAY

SUPPLY OF BREADS AND EGGS

IN KALYAN HOSPITAL Name of Work with Location: E-Tender for Supply of Breads and Eggs in Central Railway Hospital Kalyan, Earnest Money to be Deposited: ₹ 12,000/ (Rupees Twelve Thousand only) Completion Period of Work: 02 (Two Years. (From 01/08/2020 to 31/07/2022) Last Date and Time of Submission of E-Tender: 27/07/2020 (Time Upto 15.00) hrs.). Date and Time of Opening of E-Tender: 27/07/2020 (Time 15.30 hrs.). Website Where Complete Details of Tender with its Requirement: www.ireps.gov.in Tender Notice No.: KYN/H/E/Tender/ Breads and Eggs/2020-22 Date:04/07/2020

Railway Helpline 139

DELHI JAL BOARD: GOVT. OF N.C.T OF DELHI OFFICE OF THE EXECUTIVE ENGINEER (PROJECT) W-VIII A- BUILDING, VARUNALAYA, JHANDEWALAN, NEW DELHI-110005 NIT No: 01/(2020-21)

Amount put to Earnest money | Tender Fee Date of | Last date/time of Name of work NO. submission of tender release of tender tender 07.07.2020 05.08.2020 up to Installation of Tube Wells in Flood Civil Work:- Rs. Rs. 81,40,000/- Rs. 1500/-Plain of Palla and other suitable 40,48,95,141/-(minimum Rs. 20 3:05 PM locations for augmentation of E&M Work:-Lac to be transmitted Refundable) throught RTGS and water supply Item Rate Tender ID: balance through BG) 2020 DJB 192411 1

Note: Any further amendment/ corrigendum made in this NIT will be uploaded and can only be seen on website http://govtprocurement.delhi.gov.in

BCL Industries LIMITED

Particulars.

PROFIT BEFORE EXCEPTIONAL ITEMS AND TAX (3-4)

PROFIT BEFORE TAX AFTER EXCEPTIONAL ITEMS

PAID UP EQUITY SHARE CAPITAL (F.V. Rs. 10/- each)

EARNINGS PER SHARE (of Re. 10/- each) (not annual-

se abstract of the Standalone Anodited Financial Results for Quarte

Net Profit / (Loss) for the period (before Tax, Exceptional

Net Profit / (Loss) for the period after tax (after Exceptional

Total Comprehensive Income for the period [Comprising

Profit / (Loss) for the period (after tax) and Other Compre

NET PROFIT (AFTER TAX AND EXCEPTIONAL

OTAL REVENUE FROM OPERATIONS

TOTAL COMPREHENSIVE INCOME

(a) Basic (Rs.)

(b) Diluted (Rs.)

Total Income from Operations

and/or Extraordinary items#)

and/or Extraordinary items#)

sensive Income (after tax)]

DATED :- 06-07-2020

Place -Bathinda (PB.)

XTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR QUARTER/ YEAR ENDED 31ST MARCH, 2

ISSUED BY PRO (WATER) Advt. No. J.S.V. 95/2020-21 E.E. (Project) W-VIII

3 Months

ended

31.03.2020

(Audited)

22583.62

637.73

637.73

348.51

424.37

1915.00

1.82

1.81

22583.68

632.1

342.88

418.74

The above is an extract of the detailed format of Consolidated Quarterly Financial Results filed with the Stock Exchange (BSE) under Regu-

lation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 . The full format of Audited Consolidated and Stadalor

Financial Results are available on the websites of the Stock Exchange i.e. www.bseindia.com and on company's website i.e. www.bcl.ind.in

AFFAIRS

Regd. Office : Hazi Rattan Link Road, Bathinda-151001

Website: www.bcl.ind.in, Email: bcl@mittalgroup.co.in

Year

ended

31.03.2020

(Audited)

92550.54

3489.15

3489.15

2584.93

2660.79

1915.00

19834.96

13.5

13.49

92549.91

3504.39

2600.17

2676.03

For and on behalf of the Board of Directors

(RAJINDER MITTAL)

.....THE PETITIONER

CIN: L24231PB1976PLC003624

RS. IN LAKHS

Previous

Year

ended

31.03.2019

(Audited)

90368.93

5175.77

5175.77

4127.64

4216.15

1743.30

6543.49

24.07

23.99

90368.31

5191.23

4143.1

4231.61

Mg. Director

AFFAIRS

Ph.: 0164-2240163, 2240443, 2211628, Fax: 0164-5003630

CONSOLIDATED

Corresponding

3 Months

ended

31.03.2019

(Audited)

24973.43

965.87

965.87

696.24

801.43

1743,30

16478.77

4.08

4.07

24972.9

972.95

703.32

808,51

PUBLIC NOTICE

Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014]

BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES

ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES

IN THE MATTER OF JIGAR COMMODITIES & DERIVATIVES PRIVATE LIMITED (CIN

U74999DD1988PTC004731) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141.

Notice is hereby given to the General Public that the Company proposes to make

application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking

Preceding

3 Months

ended

31.12.2019

Unaudited)

26833.36

911.3

911.3

841.96

841.96

1915.00

19406.62

4.41

4.41

in as give

26833.31

917.95

848.61

848.61

CLASSIFIED CENTRES IN MUMBAI Beejay Ads, Opera House Phone : 23692926 / 56051035.

Byculla (E), Phone: 23748048 | 23714748.

FCA Communications. Nariman Point, Phone: 40020550 / 51. Fulrani Advtg. & Mktg. Antop Hill Phone: 24159061 Mobile: 9769238274/ 9969408835

Ganesh Advertising, Abdul Rehman Street, Phone: 2342 9163 / 2341 4596.

Phone: 22663742. Mani's Agencies, Opp.G.P.O., Fort. Phone: 2263 00232. Mobile : 9892091257.

Manjyot Ads,

Currey Road (E)

Phone: 24700338. Mobile: 9820460262. OM Sai Ram Advtg., Currery Road Mobile: 9967375573 Pinto Advertising, Mazagaon, Phone: 23701070.

Premier Advertisers Mumbai Central Mobile: 9819891116

Sarjan Advertising, Phone: 66626983

> **PUBLIC NOTICE** Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE **AFFAIRS**

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

IN THE MATTER OF NIRSHILP COMMODITIES AND TRADING PRIVATE LIMITED (CIN: U67120DD2002PTC004739) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE

NO.141, CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU. Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking

confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June. 2020 to enable the Company to change its registered office from "Union territory of Daman" & Diu" to "State of Guiarat". Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in)

by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below:

Regd Off.: Office no.141, For and on behalf of Applicant Center Point, Somnath, For Nirshilp Commodities And Trading Private Limited Daman-396210, Daman & Diu

Mr. Harendra D. Shah Place : Mumbai Whole Time Director Date : July 06, 2020 DIN: 0001260

& Diu" to "State of Gujarat".

(INCORPORATION) RULES, 2014

confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June, 2020 to enable the Company to change its registered office from "Union territory of Daman Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in

CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.

by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below: Regd Off.: Office no.141, For and on behalf of Applicant

Center Point, Somnath, For Jigar Commodities & Derivatives Private Limited Daman-396210, Daman & Diu Mr. Harendra D. Shah Place: Mumbai Director

Date : July 06, 2020 DIN: 00012601

PUBLIC NOTICE

Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

IN THE MATTER OF PURVAG COMMODITIES & DERIVATIVES PRIVATE LIMITED (CIN: U74999DD1993PTC004749) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141, CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.

Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking

confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June, 2020 to enable the Company to change its registered office from "Union territory of Daman" & Diu" to "State of Guiarat" Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in

by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below:

Regd Off.: Office no.141, For and on behalf of Applicant Center Point, Somnath, For Purvag Commodities & Derivatives Private Limited. Daman-396210, Daman & Diu Sd/-

Mr. Rajendra D. Shah Place : Mumbai Director Date : July 06, 2020 DIN: 00005013

Place of Tender

Submission, Tender

open & Auction

Au Small Finance

Third floor Above

Bank of India Near

Santosh Nagar Bus

stop, opp Shell

Petrol Pump Aundh

Ravet BRTS road

dange Chowk CSM

Flyover Chinchwad

Pune - 411033

Address: - The Hub 9075000439

Contact Person

and Property

Visit Date

Mujahid

Khan-

12-Aug-20

PUBLIC NOTICE Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE **AFFAIRS**

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

IN THE MATTER OF SHAILESH SHAH SECURITIES PRIVATE LIMITED (CIN: U65990DD1988PTC004733) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141. CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.

.....THE PETITIONER

Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June, & Diu" to "State of Gujarat".

2020 to enable the Company to change its registered office from "Union territory of Daman Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date o

Read Off.: Office no.141, For and on behalf of Applicant Center Point, Somnath. For Shailesh Shah Securities Private Limited. Daman-396210, Daman & Diu

address mentioned below:

publication of this notice with a copy to the Applicant Company at its registered office

Mr. Harendra D. Shah Place: Mumbai Director Date : July 06, 2020 DIN: 00012601

PUBLIC NOTICE Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE **AFFAIRS**

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of

the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June. 2020 to enable the Company to change its registered office from "Union territory of Daman & Diu" to "State of Gujarat". Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the

ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below: Read Off.: Office no.141. For and on behalf of Applicant Center Point, Somnath. For Dolat Capital Market Private Limited.

Daman-396210. Daman & Diu Mr. RAJENDRA D. SHAH Place: Mumbai Director PUBLIC NOTICE Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE **AFFAIRS**

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

AND

IN THE MATTER OF VAIBHAV STOCK & DERIVATIVES BROKING PRIVATE LIMITED (CIN: U67120DD2004PTC009816) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141, CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.THE PETITIONER Notice is hereby given to the General Public that the Company proposes to make

application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June 2020 to enable the Company to change its registered office from "Union territory of Damar & Diu" to "State of Gujarat". Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the

publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below: Read Off.: Office no.141. For and on behalf of Applicant Center Point, Somnath, For Vaibhav Stock & Derivatives Broking Pvt. Ltd. Daman-396210, Daman & Diu

ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor

100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date o

Mr. VAIBHAV P. SHAH Place: Mumbai Director Date: July 06, 2020 DIN: 03472526

PUBLIC NOTICE Form no INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] BEFORE THE REGIONAL DIRECTOR, WESTERN REGION, MINISTRY OF CORPORATE

IN THE MATTER OF THE SUB-SECTION (4) OF SECTION 13 OF THE COMPANIES ACT, 2013 AND CLAUSE (a) OF SUB-RULE (5) OF RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

IN THE MATTER OF NIRPAN SECURITIES PRIVATE LIMITED (CIN U67120DD1993PTC004732) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141 CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.THE PETITIONER

Notice is hereby given to the General Public that the Company proposes to make application to the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of

the special resolution passed at the Extra Ordinary General Meeting held on 25th June 2020 to enable the Company to change its registered office from "Union territory of Daman & Diu" to "State of Gujarat". Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the Company may deliver either on MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his her objections supported by an affidavit, stating the nature of his / her interest and the ground of opposition to the Hon'ble Regional Director, Western Region, Everest 5th Floor,

100 Marine Drive, Mumbai - 400002, Maharashtra, within fourteen days from the date of

publication of this notice with a copy to the Applicant Company at its registered office address mentioned below: Read Off.: Office no.141. For and on behalf of Applicant Center Point, Somnath, For NIRPAN SECURITIES PRIVATE LIMITED. Daman-396210. Daman & Diu

Mr. Harendra D. Shah Place : Mumbai Date : July 06, 2020

Managing Director DIN: 00012601

Mastek * **MASTEK LIMITED**

Registered Office: 804/805, President House, Opp. C. N. Vidyalaya, Near Ambawadi Circle, Ambawadi, Ahmedabad - 380 006, Gujarat, Tel: +91-79-2656-4337; Fax: +91-22-6695 1331; E mail: investor_grievances@mastek.com; Website: www.mastek.com NOTICE

FOR THE ATTENTION OF

CIN: L74140GJ1982PLC005215

EQUITY SHAREHOLDERS OF THE COMPANY Transfer of Unclaimed Dividend and Underlying Equity Shares for the Financial Year 2012-13 of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority

NOTICE is hereby given pursuant to Section 124 of the Companies Act, 2013 ("the Act") and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time read with the relevant circulars and

amendments thereto ("the Rules"). The Rules, inter-alia, provides that the shares in respect of which the dividend has remained unpaid or unclaimed for a period of 7 (seven)

of the IEPF Authority. In terms of the said Rules, final dividend declared by Mastek Limited (the 'Company') for the Financial Year 2012-13 which has remained unpaid or unclaimed for a period of consecutive 7 (seven) years will be credited to the account of IEPF Authority on the due date. Also,

consecutive years or more, are to be transferred to the Demat Account

underlying shares on which such dividend has remained unpaid or unclaimed for 7 (seven) consecutive years will also be transferred to the IEPF Authority in August, 2020. However, the Company will not transfer such shares where there is a specific order of Court or Tribunal or any other Statutory Authority restraining any transfer of shares and payment of dividend or where

such shares are pledged or hypothecated under the provisions of the

Depositories Act, 1996.

underlying shares.

In compliance with the requirements of the said Rules, the Company has, vide its letter dated July 6, 2020, communicated individually to all those shareholders whose shares are liable to be transferred to the IEPF Authority in the month August, 2020, at their registered addresses. The Company has also uploaded full details of those shareholders on its website at the link https://www.mastek.com/in/investor-information. Shareholders are requested to refer to the aforesaid website to verify the details of unclaimed dividends and the shares which are liable to be transferred to the IEPF Authority and thereafter contact the Company for making a valid claim in respect of such unclaimed dividend and the

In case the Company does not receive any communication from these shareholders by August 14, 2020, the Company shall, with a view to complying with the requirements set out in the Act and the Rules, transfer the shares to IEPF Authority on the due date as per procedure stipulated in the Rules without giving further notice, in the following

 a) In respect of shares held in Physical Form: The Company shall issue new share certificates in lieu of the original share certificates held by the concerned shareholders for the purpose of dematerialisation by way of corporate action and transfer of shares to IEPF Authority as per the Rules and upon such issue, the original share certificates which stand registered in the name of concerned shareholder will stand automatically cancelled and be deemed to be non-negotiable.

 b) In respect of shares held in Dematerialised Form: The Company shall inform the depository to transfer the said shares in favour of DEMAT account of IEPF Authority by way of corporate action.

The concerned shareholders are requested to note that no liability shall lie against the Company in respect of the unclaimed dividend amount and the underlying shares so transferred. The concerned shareholders may also note that both the unclaimed dividend and the underlying shares transferred to IEPF Authority including all benefits accruing on such shares, if any, except the right shares can be claimed back by the concerned shareholders from IEPF Authority after following the procedure prescribed under the Rules which is displayed on the website www.iepf.gov.in.

For any queries / information / clarification in the subject matter, shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents M/s. KFin Technologies Private Limited, Unit: Mastek Limited, Selenium Tower B, Plot 31-32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032, Telangana Phone: +91 40 67161563 | Toll free number: 1800 345 4001 | Email id: einward.ris@kfintech.com (K.A.: Mr. Rajesh Kumar Patro, Deputy Manager) or may write to Mr. Dinesh Kalani, Company Secretary by sending Email to dinesh.kalani@mastek.com

> For Mastek Limited Dinesh Kalani Company Secretary

Note: - This is also a 30 day's notice Under Rule 8(6) read with rule 9(1) to the Borrowers/Co Borrowers/Mortgagors of the above said loan account about sale through tender / inter se bidding on the above-mentioned date. The property will be sold, if their outstanding dues are not repaid in full by the borrower. Date: 07/07/2020 Authorised Officer AU Small Finance Bank Limited Place : Pune financiale

For detailed terms and condition of the sale, please refer to the link provided in AU Small Finance Bank LTD Secured Creditor's website https://www.aubank.in/bank-auction

U SMALL FINANCE BANK LIMITED (Formerly known as Au FINANCIER'S (INDIA) LIMITED)

Earnest

Price For Money For Time Of

1.00.000/

Rs. One

Lakh only

Date &

to

2.00 PM

with

unlimited

extension

of 5

minutes

Property | Property | Auction | Submission

Date &

Time of Bid

to

5.00 PM

10.30 AM 10.00 AM Bank Ltd., Branch

13-Aug-20 12-Aug-20

Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001, Rajasthan, (India). (CIN:L36911RJ1996PLC011381)

11,50,000/-

Rs. Eleven

Lac Fifty

Thousand

APPENDIX-IV-A

[See proviso to rule 8(6)]

Sale notice for sale of immovable properties

Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property

mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of AU Small Finance Bank LTD.

(formerly known as Au Financiers (India) Ltd.) Secured Creditor, will be sold on "As is where is"," As is what is " and " Whatever there is" basis. The

Description of

Property

Property Bearing

Gat No. 247, Hissa

No. 9, Within

Panchayat Samiti

Maval and Zilla

Parishad Pune.

Maharashtra

00 H 40 ARE Out of

Which Admeasuring

1000 Sq. Feet

alongwith RCC

construction

IN THE MATTER OF DOLAT CAPITAL MARKET PRIVATE LIMITED (CIN:

U65990DD1993PTC009797) HAVING ITS REGISTERED OFFICE AT OFFICE NO.141. CENTER POINT, SOMNATH, DAMAN-396210, DAMAN & DIU.THE PETITIONER

Date : July 06, 2020 DIN: 00005013

SD/-

Place : Mumbai

Date : July 6, 2020